



જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,  
ઓ/૩, જિલ્લા સેવા સાદન-૨,  
અઠવાલાઈન્સા, સુરત

Web : suratdeo.org

Email : suratdeo@gmail.com

તા. ૨૩/૦૮/૨૦૨૩

૦૧૦૫/૦૮/૨૦૨૩

પ્રતિ,

આચાર્યશ્રી,

તમામ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ

સુરત.

- સામેલ પરિપત્રનો તમામ શાળાઓએ ચુસ્ત અમલ કરવા સારું.

નિર્ભાવ  
જિલ્લા શિક્ષણાધિકારી  
સુરત, જિલ્લો-સુરત

ઈ-મેઇલ

ક્રમાંક: ધ/માધ્ય/પરચ/૨૦૨૩/૨૭૫૪૨૮-૨૯

કમિશનર શાળાઓની કચેરી,  
૬/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન.  
ગુ.રા., ગાંધીનગર  
તા.૨૮/૦૮/૨૦૨૩

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,  
તમામ.

વિષય: શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અનુસૂચિતજાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો  
ઉપયોગ કરેલ હોય તેવા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં સુધારો કરવા બાબત.

સંદર્ભ: (૧) નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર.

ક્રમાંક: અજીક/મ-૪/જા.પ્ર.જનરલ-૮/૨૦૨૩/૪૦૨૫-૨૭


(૨) કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર.

ક્રમાંક: ધ/માધ્ય/પરચ/૨૦૨૩/૬૦૫૭-૬૦૬૦.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનખ્યે જણાવવાનું કે, નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા  
શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દો બાબતે સરકારશ્રીના વિવિધ  
પરિપત્રો / ઠરાવો ની જોગવાઈ મુજબ ની કાર્યવાહી કરવા અંગે જણાવેલ છે. સદર બાબતે અગાઉ અત્રેની  
કચેરીના સંદર્ભ (૨) ના પત્રથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા: ૧૨/૧/૧૯૯૯ ના  
પરિપત્રથી શાળા છોડ્યા પ્રમાણપત્રમાં અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ ન કરવા  
અને આ બાબતે વખતોવખત લાગુ પડતા/પ્રસ્તિધ્ય થતા વિવિધ પરિપત્રો/ઠરાવો/સરકારશ્રીની સુચનાઓનું  
અને આ બાબતે વખતોવખત લાગુ પડતા/પ્રસ્તિધ્ય થતા વિવિધ પરિપત્રો/ઠરાવો/સરકારશ્રીની સુચનાઓનું  
યોગ્ય અને ચુસ્તપણે અમલ કરવા આપની કક્ષાએથી તમામ શાળાઓને ખાસ સુચના આપવા જણાવેલ હતું.

ઉક્ત વિગતે અત્રેના સંદર્ભ (૨) ના પત્રની વિગતે તેમજ સંદર્ભ (૧)ના નિયામક, અનુસૂચિત  
જાતિ કલ્યાણ, ગાંધીનગર ના સંદર્ભ (૧)ના પત્રમાં જણાવેલ સરકારશ્રીના પરિપત્રો તથા ઠરાવો નું ચુસ્તપણે  
અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા આશી જણાવવામાં આવે છે.

બિડાણ : ઉપર મુજબ.

  
નાયબ શિક્ષણ નિયામક  
માધ્યમિક  
ગુ.રા., ગાંધીનગર.

નિયમાં અનુસૂચિત જાતિ કર્યાએ,  
૧/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર  
કોન નં. ૦૭૬ ૨૩૨ ૫૪૧૭૮,  
તા. ૧૮/૦૮/૨૦૨૩.

પ્રતિ,

(૧) કમિશ્રરશ્રી

કમિશ્રર શાળાઓની કચેરી,  
બ્લોક નં-૮/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

(૨) નિયામકશ્રી,

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,  
બ્લોક નં. ૧૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

**વિષય :** શાળા છોડી દીઘેલ હોચ કે શાળાકીય અભ્યાસ પૂર્ણ કરેલ હોચ તેવા કિસ્સામાં શાળા  
છોડ્યાના પ્રમાણપત્રમાં અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ  
કરેલ હોચ તેવા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં સુધારો કરવા બાબત.

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે જ્ઞાતિ નિર્મૂલન સમિતી, જી. અમદાવાદની  
તા. ૦૩/૦૮/૨૦૨૩ ની રજૂઆતની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. સદરહું  
રજૂઆત અન્વયે નીચે જણાવેલ ઠરાવો/પરિપત્રો થી થયેલ જોગવાઈ મુજબ નિયમોનુસાર ઘટતી  
કાર્યવાહી કરવાની થાય છે.

(૧) સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના  
તા. ૧૨/૧૨/૧૯૯૯ના પરિપત્ર ક્રમાંક - એસ્સીડબલ્યુ / ૧૦૮૦ / ૧૪૯૮ / ૯ થી  
અનુસૂચિત જાતિના લોકો માટે “હરીજન” તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે “ગિરિજન”  
જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરવા બાબતની સૂચનાઓ પરીપત્રિત કરવામાં આવેલ છે. (નકલ  
સામેલ છે)

(૨) સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના  
તા. ૦૯/૦૮/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક - અજસ / ૧૦૮૩ / મુ. મ. ૯૦ / ૯ થી અનુસૂચિત  
જાતિના સંબંધિત ઈસમોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અગર તો રેવન્યુ રેકર્ડમાં જાતિના  
કોલમમાં “ભંગી” શબ્દ પ્રયોજનેલ હોચ તો પણ સંબંધિત ઈસમોની માંગણી મુજબ

અનુસૂચિત જાતિ “વાટિમકી” અગરતો અનુસૂચિત જાતિ “રખી” એ પ્રમાણે જાતિ પ્રમાણપત્રો .  
આપવા બાબતે છરાવવામાં આવેલ છે.

(3) સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના  
તા.૧૮/૧૦/૨૦૧૫ના પરિપત્ર કુમાંક- અહલ / ૧૨૨૦૧૬ / જ્યોતિષ / હથી “ચમાર”  
શબ્દના સ્થાને તેનો પર્યાય શબ્દ “રોહિત” શબ્દ પ્રયોજવા બાબતની સૂચનાઓ પરીપત્રિત  
કરવામાં આવેલ છે. (નકલ સામેલ છે).

નિયામક

અનુસૂચિત જાતિ કલ્યાણ  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર

નકલ રવાના જાણ સારુ :-

કન્ફીનરશ્રી,  
જાતિ નિર્ભૂલન સમિતિ, એ-૨૦૨ બીજોમાળ,  
કુદરત હાઇટ્સ, નરોડા પાટીયા, અમદાવાદ.

અનુસૂચિત રાજીના વોકો માટે 'ઉરણ' તા.  
અનુસૂચિત અન્યરાજીના વોકો માટે 'ગેરણ'  
એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવા જાયતે ~

ગુજરાત રાજીના,  
સામાજિક - રાષ્ટ્રીય અધિકારીના વિભાગ,  
પરિપત્ર નંબર : એસ્સીડિબલ્યુ - ૧૦૬૦/૧૪૫૬/૫  
સચિવાલય, ગાંધીનગર  
તા. ૬૨ - ૩ - ૧૬૬૬:

૫૩

### વચ્ચાણે લિધાં:-

- (૧) ભારત રાજીના ગૃહ મત્રાલયનો તા. ૧૦/૨/૮૨ નો પત્ર ક્રમાંક ૫૮-૩/૧  
૧૨૦૨૫/૫૪/૮૦ - એસ્સી અને બીસીડી-૧/૪
- (૨) - ભારત રાજીના કલ્યાણ મત્રાલયનો (હાલમાં નામ સામાજિક - યાય  
અને અધિકારીના મત્રાલય) તા. ૧૯/૮/૬૦ નો પત્રક્રમાંક: ૧૨૦૨૫/૧૪/૬૦/  
એસ્સીડી/ (સાર. એલ. સેન)
- (૩) સર્વે વિભાગને સખોધીને લખવામાં આવેલસમાજ કલ્યાણ વિભાગનો તા.  
૧૮/૩/૬૧ નો પત્ર ક્રમાંક: એસ્સીડિબલ્યુ/૧૦૬૦/૧૪૫૬/૫
- (૪) નિયામકક્ષી, સમાજકલ્યાણ ખાતાને સખોધીને લખવામાં આવેલ સમાજ કલ્યાણ  
વિભાગનો તા. ૨૬/૩/૬૧ નો પત્રક્રમાંક: એસ્સીડિબલ્યુ. ૧૦૬૦/૧૪૫૬/૫
- (૫) નાયથ આદિજાત વકાસ કર્મશનરક્ષી, ગાંધીનગર, કાર્યપાલક નિયામકક્ષી,  
ગાંધીનગર તેમજ સર્વે પ્રાયોજના વહીનાટદારક્ષીઓને સખોધીને લખવામાં આવેલ  
સમાજ કલ્યાણ અને આદિજાત વકાસ વિભાગ (આદિજાત વકાસ પ્રભાગ) નોંધાનાં  
તા. ૪/૫/૬૧ નો પત્ર ક્રમાંક: અન/૧૬૬૧/૩૩૧/૨
- (૬) સચિવાલયના સર્વે વિભાગો અને સમાજ કલ્યાણ વિભાગ છેઠળના ખાતાના  
ગાંધીનગર કલ્યાણ વિભાગ

4 12 4 प. :-

ભારત સરકારના શુભ પત્રાલયે બામુખ્ય (જ્ઞાનોસ તા. 10/2/62) ના પત્રથી

અને તે સમયના ઉદ્ઘાટણ પત્રાલયે(જાલમ) સામાજીક -ધાર્ય મેળવણીએ પત્રાલય

બામુખ્ય (જ્ઞાનોસ તા. 13/6/62) ના પત્રથી તેણીક સૂચનાઓ પુરિષધ કરેલ હોય.

ખરું કરીને ઉપરોક્ત પત્રાલયે અનુસૂચિત જાતના જ્ઞાનોસ માટે 'ગુરુજન' -

શિદનો અને અનુસૂચિત જનજાતનાલોકો માટે 'ગુરુજન' શિદનો ઉપયોગ નહીં

કરવા અગેની સૂચનાઓ પુરિષધ કરેલ હોય. ભારત સરકારના ઉપરોક્ત પત્રાની નાથી

સચિવાલયના સર્વે (કલાગોને, કલાગ છેઠળના ખાતના નાના કયેરીઓને, તેમજ

મ્યાં કયેરીઓને; બામુખ્યમાં જ્ઞાનોસ સમજી ઉદ્ઘાટણ (કલાગના તા. 9/3/61,

તા. 25/3/61, તા. 8/3/61) અને તા. 25/3/61 ના પત્રથી મોકલી આપીને

ભારત સરકારના ઉપરોક્ત પત્રામાં જ્ઞાનોસ (જાતે સૂચનાઓનો) રૂતાણે બાદ કરાયું

જાનવામાં આપેલ હોય.

2/- ભારત સરકારના ઉપરોક્ત પત્રામાંની સૂચનાઓના આધારે, વગતનાર

સૂચનાઓનાર પાઠનાની ખાપત તેણીક સમયથી રાજ્ય સરકારની નિરાશા

હેઠળ હતી. આ અને કાળજીપૂર્ણ કંઈ પુછત વિચારણાને અણે આવી ગુજરાત

સૂચનાઓ આપીનું આપોયો.

(૨) ગુજરાત સરકારના તમામ જ્ઞાનોસી (કલાગ) તથા તેમના જ્ઞાનોસીનો નમામ

નોટીસી કયેરીઓ(બોર્ડ)નાના (નગમ રાખત) લાંબા નમામ ફારાસ (ડોકેઝ) (સરકારી

તેમજ (ખર સરકારી), તમામ શુનનારીસી જેણાં ૨૫૩૮ (૪૫) ૧૫(૨૪) શિદ

ધ્યોનાયેલ હોન લ્યા નેના સાથે અનુસૂચિપ રાખાં જરેન અભિભૂતના રાખે

નાના પદ્ધતાની નાના પદ્ધતાની પદ્ધતાની પદ્ધતાની પદ્ધતાની પદ્ધતાની.

- (२) મહાકારપાત્રકાલો, વરસાંગાલો તથા કૃત્તિ પાયાના ૩૫૭૫૦ તથા  
અથ મહેશૂલી ૨૫૭૫૦ એંધ ઉપર મુજબ સુધીરો કરાયા.
- (૩) ગારત સરકારે હે. ૧૭૮ નું સુધીરા અધિનિયમી દ્વીપ રાજ્ય તથા ગ્રામ  
કુટીએ અનુસૂચિત જાત તેમણે મુજબ આપી જાની જાએ અને પાઠેણી.  
શરૂઆત રાજ્ય ગારેનો અનુસૂચિત જાતીની વાતાવરણ દર્શાવી જાની જાએ।  
સૌંદર્યાને હાલમાં ૧ હજાના પરીક્ષે ઓદિયામાં આપી જાની જાએ તે મુજબ રાખોધન  
૫૨૧૫૦ આંતું હોય તાં તેને બદલે હોવી અનુસૂચિત જાત ( Scheduled Caste )  
તરીકે ઓદિયામાં આંતે તેમણે સંબોધન કરાયા આંતે. એ પ્રમાણે ગુજરાત રાજ્યને  
ખાતી અનુસૂચિત જનજાતની વાદીમાં દર્શાવી કોઈ જાત પેટાજાઈતર ને હાલમાં  
'ગ્રાન્ડ્સ' તરીકે ઓદિયામાં આંતું હોય કે જે મુજબ સંબોધન કરાયા આંતું  
હોય તાં તેને બદલે હો અનુસૂચિત જાતી ( Scheduled Tribe ) તરીકે ઓદિય પાં  
અંતે તેમણે સંબોધન કરાયા આંતે.
- (૪) ગુજરાત રાજ્ય માટે અનુસૂચિત જાતના તથા જનજાતની વાદીમાં દર્શાવી  
કોઈ કોઈ રૂટાંદી પેટાજાઈતા હસમે શામા નોયાનું પ્રમાણપત્ર આપનામાં આંતે  
ત્યારે શામા નોયાના પ્રમાણપત્રમાં અનુસૂચિત જાતના હસમ માટે ૧૯૮૨જની  
એ અનુસૂચિત જાતના હસમ માટે ૧૧ ગ્રાન્ડ્સ ૧૧ રૂપદો પ્રયોજન ૧૧  
લખાં નથી. પરતુ અનુસૂચિત જાતને અનુસૂચિત જન જાતની વાદીમાં દર્શાવી  
કોઈ રૂટાંદી પેટાજાઈતા નથી કોઈ રૂટાંદી પેટાજાઈતા લાગુ પડતી હોય,  
રાખોધન હોય કે કોઈ જાત પેટાજાઈતા હોઈએ. અને તાં અનુસૂચિત જાતની  
જનજાતની તરીકે દેખેણ કરાયા.

(4) અનુસૂચિત જાતનું અનુસૂચિત જનજાતના હસમને જાત પ્રમાણપત્ર આપતા

સર્કાર અધ્યક્ષારીકોણે જાત પ્રમાણપત્રમાં ॥ ૭૧૨૪ન / ગુરજન ॥૩॥

શર્દોના ઉલ્લેખ ૫૨નો નહીં. પરંતુ અનુસૂચિત જાત જનજાતની કાઠીમાંની

કાંઈ જાત કે રાખાશ : હસમને વાગું પડતીની રાખપણ હોય તે જાતની ઉલ્લેખ

૫૨ની. દાખા તરીકે । ૫૨૫૨ જાતના એક હસમને અનુસૂચિત જાત તરીકેનું

પ્રમાણપત્ર આપું હોય, તો પ્રમાણપત્રમાં જાતના કાંઈમાં । ૫૨૫૨ દર્શાવ્યું.

એ એ પ્રમાણે । દોડિયા । જાતના એક હસમને અનુસૂચિત જનજાત તરીકેનું

પ્રમાણપત્ર આપું હોય, તો પ્રમાણપત્રમાં જાતના કોણમાં । દોડિયા । દર્શાવ્યું.

(5) આ ૫૨૮૫ના ૫૭.૧૨ ૫૧૭.૧૭ બાબોને બેન્ટારીની પહેલાં તે હસમને રાજા

દોડયાના પ્રમાણપત્ર મેળવી લીધા હોય અને એ હસમને શરીર દોડયાના પ્રમાણપત્રમાં

। ૭૧૨૪ન / ગુરજન / શર્દોના ઉલ્લેખ થઈ ચુકેલ હોય તો તેથા હસમને અનુસૂચિત જાત

અનુસૂચિત જનજાતની જરૂરીએટાનું પ્રમાણપત્ર આપવાના બાધ રાખનો નહીં. મરંજ પ્રમાણપત્રમાં

અનુસૂચિત જાત / અનુસૂચિત જનજાત । શર્દોના બ્લ્યુક ઉલ્લેખ ૫૨૮૫. દા.ત. એક

ઉચ્ચમના શરીર દોડયાના પ્રમાણપત્રમાં । ૭૧૨૪ન દા.ત. । તરીકેનો ઉલ્લેખ ૫૨૮૫માં

આપેલ છે તે હસમને અનુસૂચિત જાત તરીકેનું પ્રમાણપત્ર આપ્યું પરંતુ, પ્રમાણપત્રમાં

અનુસૂચિત પાણા । એઓ ઉલ્લેખ ૫૨૮૫. આ મુદ્રા પૂરતી સૂચના અને પ્રોનો ૨૫૦૮તા

સમાજ કલ્યાણ

માટે ચાંચાણના વા. ૧૩-૧૦-૮૮૮૮. ૩૨૩૧૮૮ ૬૨૧૧ ૬૫૦૬: ૫૨૪/ ૧૭૮૨/

૩૭૨/૭૧, ૮ ઓગાઝનો સાધારણ તેવા નિયતી ૫૨૮૫માં આપેલ.

- આ પરિવહ રોજ પરોચા વ્યાપકાંશી એ સરકારી પણ નાભારાયુદ્ધ કરતું  
ગેરાધન હથી નર્સ નાપરા પાટે અ. પરતુ આ પરિવહની મુજબાયત કરતું મનુષીની  
મનોદૂરના હોલ્ડ પાટે ખાદ્યાંશ એ ગંગ દેશાંક રોજગારમાં પ્રરાગણા થિએ.  
ખર્ચીની કરે ને એ લેખાં પાઠ્યપાત્ર વાત લાગેને કોઈ નાપરીત મસર એ નહીં.

૫/- ઉપરોક્ત સૂચનાઓનો અમલ કૃતાન્તે વાય ને પાટ મલધિત (નામાં) / ખાતાના કરા  
કરીના રહાયો, જેરે આવી શાર્પૂર્ઝ નની કરણાંદ્ર આવે ને.

ગુજરાતા રાજ્યપાલકીના હુકમથી એ નેમના નામે,

રૂપાલા  
(ન.ના. ૫૨૫૧૨),

૩૮૮/૧૯૫ -યાચ અને અનુભૂતિની વિણાગ.  
ગુજરાત રાજ્યકાર્યાલય, ગુજરાત રાજ્યકાર્યાલય, વિણાગ.

પ્રત,

- X માન. રાજ્યપાલકીના સચિવકી, રાજ્યાંશ, ગાંધીનગર.
- માન. મુખ્યમંત્રીના સચિવકી, સચિવાલય, ગાંધીનગર.
- સર્વે માન. મંત્રીદીઘોસ્થી અંત સચિવકીઓ, સચિવાલય, ગાંધીનગર.
- માન. પ્રાધ્યક્ષાના નેતાકીના અંત સચિવકી, પ્રધાનમંદિર, સચિવાલય, ગાંધીનગર.
- સર્વે માન. રાજ્યકાર્યાલયના મંત્રીદીઘોસ્થીઓ, ..
- સર્વે માન. નાયદુ મંત્રીદીઘોસ્થીઓ અંત સચિવકીઓ, સચિવાલય, ગાંધીનગર.
- સચિવાલયના સર્વે નિષાગ (નેમના નાનીંટી નબદ્રા ડેઠના પાતાયો) / કરેરીઓના  
ના/ ૫૦૨/ કોપારિશન/ દુર્નાશુટીઓ જેરે આ ઓની જાણ કરણાંદ્ર નની સેછ.
- X રંગીસ્ટ્રાર્સીઓ; નામેના ગુજરાત કાઉન્સિલ, અમદાવાદ.
- X અન્યાંશી, ગુજરાત તક્કેદારી કાન્યોગ; ગાંધીનગર.
- X અન્યાંશી, ગુજરાત જાહેર કેન્દ્ર આયોગ, અમદાવાદ.
- X સચિવકી, ગુજરાત નાનયાલા કાન્યોગ, ગાંધીનગર
- X કોર્ટીની, ગુજરાત કોર્ટીના રેલા પરંપરાની મંડળ, અમદાવાદ.

અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમોના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અગર તો રેવન્યુ રેકર્ડમાં જાતિના કોલમમાં 'ભંગી' શાલ્ડ પ્રયોજનીય હોય તો પણ સંબંધિત ઈસમોની ગાંગાણી મુજબ અનુસૂચિત જાતિ 'વાલિંકી' અગરતો અનુસૂચિત જાતિ 'રૂખી' એ પ્રમાણી જાતિ પ્રમાણપત્રો આપવા બાબતા.

### ગુજરાત સરકાર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ.

દરાવ ક્રમાંક : અજસ / ૧૦૮૩ / મુ. મ. ૬૦/૬.

સચિવાલય, ગાંધીનગર.

તારીખ : ૬-૮-૨૦૦૫.

### સરકારે જીધા

- સમાજ કલ્યાણ વિભાગના તા. ૫-૮-૧૯૯૮ ના પરિપત્ર ક્રમાંક : અજસ-૧૦૮૩-મુ. મ. ૬૦-૫.
- નિયામકશી, અનુસૂચિત જાતિ કલ્યાણ ભાતાના તારીખ ૨-૯-૨૦૦૧ નો પત્ર ક્રમાંક : અજક-મ.૩-૨૦૦૧-૧૬૭૩.

### પ્રસ્તાવના :

સરકાર હસ્તકની તમામ વહીવટો કચેરીઓ (બોર્ડ/કોર્પોરેશન/નિગમો સહિત), શાળા / કોલેજોના (સેન્ટકારી તેમજ બીજી સરકારી), યુનિવર્સિટીઓ, ગ્રામ પંચાયત, મહેસુલી વગેરેના રેકર્ડમાં જ્યાં 'ભંગી' શાલ્ડ પ્રયોજનીય હોય ત્થાં તેના સ્થાને 'વાલિંકી' અગર તો 'રૂખી' શાબ્દનો ઉલ્લેખ કરવાની સુચનાઓ વંચાણમાં લીધેલ સમાજ કલ્યાણ વિભાગને (ખાલમાં નવું નામ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ) તા. ૫-૮-૧૯૯૮ના પરિપત્રથી આપવામાં આવેલ છે. આમ છતાં શાળાના રેકર્ડમાં / પંચાયતના રેકર્ડમાં અગરતો મહેસુલી રેકર્ડમાં ઉપર જણાવ્યા મુજબનો સુધારો સંબંધિત કચેરીઓ/સંસ્થાઓ દ્વારા નદી કરવાથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મહેસુલી રેકર્ડનો દાખલો વગેરે 'ભંગી' શાબ્દના ઉલ્લેખથી આપવામાં આવતા હોય છે. પ્રસ્તુત બાબતમાં અનુસૂચિત બાબતમાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે સંબંધિત ઈસમના શાળા છોડ્યાના પ્રમાણપત્ર/રેવન્યુ રેકર્ડમાં 'ભંગી' શાબ્દ છોવા છતાં જાતિ પ્રમાણપત્ર આપનાર સંબંધિત અધિકારીશ્રીઓને સંબંધિત ઈસમો તરફથી જાતિ પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ 'વાલિંકી' તરીકે આપવા રહુંનાન થયેલ છે. પરંતુ શાળા છોડ્યાનાં પ્રમાણપત્રમાં / રેવન્યુ રેકર્ડમાં જાતિના કોલમમાં 'ભંગી' શાબ્દ પ્રયોજનીય હોય તો જાતિ પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા સંબંધિત ઈસમને અનુસૂચિત જાતિ 'વાલિંકી' અગર તો અનુસૂચિત જાતિ 'રૂખી' તરીકેનું જાતિ પ્રમાણપત્ર આપવું કે કેમ તે બાબતમાં દિવ્યા અનુભવે છે. અને વિભાગની વડી કચેરી પાસે માર્ગદર્શન માગવામાં આવે છે.

- પ્રસ્તુત બાબતમાં નિયામકશી, અનુસૂચિત જાતિ કલ્યાણે આમુખમાં ક્રમાંક : ૨ આગામ જણાવેલ તારીખ ૨-૭-૨૦૦૧ ના પત્રથી એવો અભિગ્રાય આપેલ છે કે સંબંધિત ઈસમોએ વંચાણમાં લીધેલ સમાજ કલ્યાણ વિભાગના તા. ૫-૮-૯૮ ના પરિપત્રની જાપાકારી ના અભાવે શાળા છોડ્યતા પહેલાં શાળાના રેકર્ડમાં અગરતો મહેસુલી રેકર્ડમાં અન્ય સરકારી રેકર્ડમાં 'ભંગી' શાબ્દના સ્થાને 'વાલિંકી' અગરતો 'રૂખી' એવો સુધારો કરાવેલ હોતો નથી. આ ઉપરાંત સંબંધિત સરકારી કચેરી/સંસ્થા/શાળા/ગ્રામ. પંચાયત વંદે એ વંચાણમાં લીધેલ સમાજ કલ્યાણ વિભાગના તા. ૫-૮-૯૮ ના પરિપત્રની જાપાકારીના અભાવે કે સંબંધિત ઈસમોના જાતિના કોલમમાં ઉપર જણાવ્યા મુજબ સુધારો કરેલ ન હોય તો તેવા કિસ્સામાં જે તે શાળા ઈસમોના છોડ્યાના પ્રમાણપત્રમાં મહેસુલી રેકર્ડમાં / અન્ય સરકારી રેકર્ડમાં / જાતિના કોલમમાં 'ભંગી' શાબ્દ પ્રયોજનીય હોય તો પણ 'ભંગી' શાબ્દના પર્યાપ્ત શરૂઆતો 'વાલિંકી' અગરતો અનુસૂચિત જાતિ 'રૂખી' એ પ્રમાણે જાતિ પ્રમાણપત્ર આપવું ઉચિત છે.

- કેન્દ્ર સરકારના અનુસૂચિત જાતિ : અનુસૂચિત જનજાતિ (સુધારા) અધિનિયમ ૧૯૭૫ હેઠળ બદાર પાડવામાં આવેલ ગુજરાતને લગતી અનુસૂચિત જાતિના ક્રમાંક : ૫ સામે 'ભંગી' શાબ્દના પર્યાપ્ત રૂપ શાબ્દ તરીકે જાતિઓ / પેટા જાતિ / પર્યાપ્ત શાબ્દો દર્શાવેલ છે નેમાં 'વાલિંકી' : અને 'રૂખી' શાબ્દનો પણ ઉલ્લેખ છે તેથી તેને સ્થાને લેતાં તેમજ મળેલ રજુઆત Y-1232-30

દર્શા ઉઠન હતા.

### છરાવ

પ્રસ્તુત/બાબતે કાળજીભરી વિચારણાના અંતે આથી એવું છરાવવામાં આવે છે કે સંબંધિત ઈસમોના શાખા છોડવાના પ્રમાણપત્રમાં અગરતો મહેસુલી રેકર્ડમાં / પંચાયતના રેકર્ડમાં / અન્ય સરકારી રેકર્ડમાં 'લંગી' / શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો પણ સંબંધિત ઈસમો / અનુસૂચિત જાતિ 'વાલિમકી' તરીકેનું અગરતો અનુસૂચિત જાતિ 'રૂખી' તરીકેનું જાતિ પ્રમાણપત્ર મેળવવા માગે તો જાતિ પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીશ્રીઓને 'લંગી' શબ્દના પર્યાય શબ્દ તરીકે 'વાલિમકી' અગરતો 'રૂખી' ગણીને તે પ્રમાણે તેમની માગણી મુજબનું જાતિ પ્રમાણપત્ર આપવું તથા મળવાપાત્ર દ્વારા આપવા.

૨. આ છરાવના અમલ અંગે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણએ સંબંધિત સર્વને ઘરતી કાર્યવાહી કરવાની સુધી આપવાની આથી વિનંતી કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ઢુકમથી અને તેમના નામે,

( અવાચ )

( વિ. એમ. પરમાર )

નાયબ સચિવ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ગુજરાત સરકાર

પ્રતિ,

- ૦ માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર.  
માન. મુખ્યમંત્રીશ્રીઓના સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.  
સર્વ માન. મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.  
માનનીય વિરોધ પક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.  
સર્વ માન. નાયબ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.  
સચિવાલયના સર્વ વિભાગો.
- ૦ સચિવશ્રી, ગુજરાત તકેદારી આપોગ, ગાંધીનગર.
- ૦ સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આપોગ, અમદાવાદ.
- ૦ સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
- ૦ સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
- ૦ સચિવશ્રી, ગુજરાત ગૌરૂ સેવા પસંદગી મંડળ, અમદાવાદ.
- નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

(સંબંધિત સર્વને જરૂરી સૂચના પાઠવવાની વિનંતી છે.)

તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ/જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ.

તમામ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીશ્રીઓ.

તમામ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીઓ (પંચાયત)

સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગ હેઠળના તમામ ખાતા / કંયેરીઓના વડાઓ.

સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગ હેઠળના તમામ બોર્ડ / કોર્પોરેશન.

સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગના સર્વ અધીકારીશ્રીઓ ; સર્વ શાખાઓ.

સચિવશ્રીના રહસ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગ.

સિલેક્ટ ફાઈલ.

- ૦ પત્ર દ્વારા

'ચમાર' શબ્દના સ્થાને તેનો પર્યાય શબ્દ  
'રોહિત' શબ્દ પ્રયોગ્યા બાબત.

ગુજરાત સરકાર,  
સામાજિક વ્યાય અને અધિકારીતા વિભાગ,  
પરિપત્ર કમાંક: અહિસ-૧૨૨૦૧૯-૪૫૦૮૫૯-૬,  
સચિવાલય, ગાંધીનગર.

તા. ૧૮/૧૦/૨૦૧૯

સરકારી કચેરીઓ, શાળા, કોલેજો (સરકારી તેમજ બિનસરકારી), ગ્રામ પંચાયત વગેરે  
કચેરીઓના રેકડમાં જ્યાં "ચમાર" શબ્દ પ્રયોગ્યેલ/લખાયેલ હોય ત્યાં સ્થાને "રોહિત" શબ્દનો ઉદ્દેખ  
કરવા માટે તથા પછાત વર્ગના જે જે મહોદ્ધાઓ 'ચમાર વાસ' તરીકે ઓળખાતા હોય તે મહોદ્ધાઓને  
'રોહિત વાસ' તરીકે ઓળખવામાં આવે/સંબોધન કરવામાં આવે તે માટે જરૂરી હુકમો અગર તો  
સૂચનાઓ પ્રસારિત કરવા બાબતની રજૂઆતો ગુજરાત રોહિત સમાજ સંગાંઠન તરફથી સરકારશ્રીને  
મળી હતી.

૨. આ રજૂઆતો પરત્યે સૂચનાઓ બહાર પાડવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ  
હતી, આ અંગે કાળજીપૂર્વકની પુષ્ટ વિચારણાને અંતે આથી નીચે મુજબની સૂચનાઓ આપવામાં  
આવે છે.

(૧) સરકાર હસ્તકની તમામ વહીવટી કચેરીઓ (બોર્ડ/કોરોનાન/નિગમ સહિત) તથા શાળા-  
કોલેજો (સરકારી તેમજ બિનસરકારી), યુનિવર્સિટીઓ વગેરના રેકડમાં જ્યાં "ચમાર" શબ્દ પ્રયોગ્યેલ  
હોય તેના સ્થાને "રોહિત" શબ્દનો ઉદ્દેખ કરવો.

(૨) ગ્રામ પંચાયતના રેકડમાં તથા અન્ય મહેસૂલી રેકડમાં પણ ઉપર મુજબ સુધારો કરવો.

(૩) પછાત વર્ગના જે જે મહોદ્ધાઓ "ચમાર વાસ" તરીકે ઓળખાતા હોય/સંબોધન કરવામાં  
આવતું, હોય તે મહોદ્ધાઓ "રોહિત વાસ" તરીકે ઓળખવામાં આવે/સંબોધન કરવામાં આવે.

૩. આ જાતિના ઈસમોના મહેસૂલી રેકડ/પંચાયત રેકડ અથવા અન્ય સરકારી રેકડમાં "ચમાર"  
શબ્દનો ઉદ્દેખ હોય તો પણ જો તેઓ "રોહિત" તરીકેનું પ્રમાણપત્ર મેળવવા માંગો તો આવા ઈસમોને  
સંબંધિત સક્ષમ અધિકારીઓએ "ચમાર" શબ્દના પર્યાય તરીકે "રોહિત" તરીકે તેમની માંગણી  
મુજબનું જાતિ પ્રમાણપત્ર આપવું તથા તે આધારે મળવાપાત્ર થતાં આનુષાંગિક લાભો પણ આપવામાં  
આવે.

૪. આ પરિપત્ર રોજબરોજના વ્યવહારમાં અને સરકારી પત્રવ્યવહારમાં "રોહિત શાણ્ડો પ્રયોજયા માટે છે. પરંતુ આ પરિપત્રથી અનુસૂચિત જાતિના ભાઈઓ માટે બંધારણ અને અન્ય વેદાનિક જોગવાઈઓમાં વપરાયેલા શાણ્ડો, પદ્ધયો અને તે અન્યથે તેમને ગળવાપાત્ર થતાં લાભોને કોઇ વિપરીત અસર થશે નહિએ.

૫. ઉપર્યુક્ત સુચનાઓનો અમલ ચુસ્તપણે થાય તે માટે સંબંધિત વિભાગો/ખાતાના પડા/કચેરીના પડાઓ વગેરેને આથી ભારપૂર્વક વિનંતી કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(શ્રી. બી. વણાઠારા)

સેક્રશન અધિકારી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

પ્રતિ,

માન. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર.

માન. મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.

માન. સર્વે મંત્રીશ્રીઓ/રાજ્યકષાણા/સંસદીય સચિવશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.

\* સચિવશ્રી, ગુજરાત તક્કેદારી અયોગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

\* સચિવશ્રી, ગુજરાત ગાહેર સેવા આયોગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

\* સચિવશ્રી, ગુજરાત વિદ્યાનસભા સચિવાલય, ગાંધીનગર.

\* સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

\* સચિવશ્રી, ગુજરાત ગોણા સેવા પસંદગી મંડળ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

સચિવાલયના સર્વે વિભાગો(તેઓના ખાતાઓ/કચેરીઓના પડાઓ/બોર્ડ/કોપોરેશન/યુનિવર્સિટી ઓ પગેણે આ અંગેની જાણ કરવાની વિનંતી સણ).

નિયમકશી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

નિયમકશી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. (મારફતે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હણ્ટકણા તમામ ખાતાના પડાઓ/બોર્ડ/કોપોરેશનો.)

નિયમકશી અનુ. જાતિ કલ્યાણ કચેરી)